

ચકચારી અમીત કપાસીયા મર્ડર કેસમાં લાજપોર જેલમાંથી વચગાળાના જામીન મેળવી અઢી મહીનાથી જામીન પરથી

ફરાર થયેલ આરોપીને ઝડપી પાડતી, સુરત શહેર કાઈમ બ્રાન્ચ

સુરત શહેર વિસ્તારમાં ગંભીર ગુન્હાઓમાં સજા પામેલ તેમજ કાચા કામના કૈદી તરીકે જેલમાંથી પેરોલ રજા, ફર્લો રજા અને વચગાળાના જામીન મેળવી, ફરાર થયેલ હોય, તેવા રીઢા ગુનેગારોને સત્વરે પકડી પાડવા સુરત શહેર કાઈમ બ્રાન્ચ ફરારી આરોપીઓ પકડી પાડવા પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ માણસોની ટીમ કામગીરીમાં હોય, જે દરમ્યાન પો.સ.ઈ.શ્રી.પી.કે.પટેલ નાઓની ટીમના ઠાક શૈલેષ રાધેબિહારી તથા પો.કો. મનોજ તુકારામ નાઓને મળેલ બાતમી હકિકત આધારે ઉઘના મગદલ્લા હીરો હોન્ડા શો રૂમની બાજુમાં બેંક ઓફ બરોડાની સામે જાહેર રોડ પરથી વચગાળાના જામીન પરથી ફરાર થયેલ આરોપી સુરેશ ઉર્ફે મીંટુ જયદેવ ડાકવા ઉવ-૪૭ રહે-રૂમ નં.૨૩, બિલ્ડીંગ નં.૮, એસ.એસ.સી. આવાસ સૌરભ પોલીસ ચોકીની બાજુમાં, અડાજણ, સુરત. મુળ રહે-ધુમછઈ થાના-ભંજનગર જી-ગંજામ (ઓરીસ્સા) નાને પકડી પાડી સદરી આરોપી ઉમરા પો.સ્ટે. ૧ ગુ.ર.નં.૪૭૦/૨૦૧૧ ઈ.પી.કો.કલમ ૩૦૨,૧૨૦ (બી) ૩૪,૧૮૨,૨૧૨ જી.પી.એક્ટ ૧૩૫ મુજબાન ગુનાના કામે કાચા કામના કૈદી તરીકે જેલ કસ્ટડી હોય, તેણે અને તેના સાગરીતોએ સને-૨૦૧૧ ની સાલમાં જમીનના વિવાદ પતાવવા માટે અમીત કપાસીયા નામના ઈસમની સુરત નવી કોર્ટ બિલ્ડીંગની બહાર જાહેરમાં રોડ ઉપર હત્યા કરેલ હતી તે ગુનામાં કાચા કામના કૈદી તરીકે જેલમાં હતો દરમ્યાન સદરી આરોપીએ પોતાના ઘરની આર્થિક સગવડ પુરી કરવા સાડા નામદાર ગુજ. હાઈકોર્ટના હુકમ આધારે તા.૨૬/૧૨/૨૦૧૮ થી તા.૦૧/૦૧/૨૦૧૯ સુધી દિન-૭ ની વચગાળાના જામીન પર મુક્ત થયેલ સદર આરોપીની વચગાળાના જામીન મુદત પુર્ણ થયે તા.૦૨/૦૧/૨૦૧૯ ના રોજ લાજપોર જેલ, સુરત ખાતે હાજર થવાનું હતું પરંતુ તે હાજર નહીં થઈ, ફરાર થઈ ગયેલ જેથી આરોપીને પકડી પાડી પ્રસંશનીય કામગીરી કરવામાં આવેલ છે. ગુન્હાહીત ઈતિહાસ (૧) આરોપી સને -૨૦૦૪ ની સાલમાં ઉમરા પો.સ્ટે.માં લુંટના ગુન્હામાં પકડાયેલ હતો (૨) સને -૨૦૦૯ ની સાલમાં મુન્ના ભરવાડ નામના ઈસમના મર્ડરના ગુનામાં ખટોદરા પો.સ્ટે.માં પકડાયેલ હતો.